

ભાવિનાં વિચારો: જીવનનાં અંતિમ સમયની કાળજી વિષયક અનુભવો અને નિર્ણયોનું નિરીક્ષણ અને તેસમજવા અંગે



દરદી માહિતી પત્રિકા

અભ્યાસ શીર્ષક

ભાવિનાં વિચારો: જીવનનાં અંતિમ સમયની કાળજી વિષયક અનુભવો અને નિર્ણયોનું નિરીક્ષણ અને તે સમજવા અંગે

આમંત્રણ

અમે લેસ્ટર ખાતે આવેલ LOROS હોસ્પાઇસના સંશોધકોની ટુકડી છીએ અને અમે આપને અમારા સંશોધન અભ્યાસમાં ભાગ લેવા નિમંત્રિત કરીએ છીએ. તમે નક્કી કરો ત્યાર પહેલા, અમને ગમશે કે તમે સમજો કે આ સંશોધન કેમ કરવામાં આવી રહ્યું છે અને તેમાં આપને માટે શું સમાવિષ્ટ હશે. કરી અભ્યાસ વિશે તમારા પરિવાર અને મિત્રો સાથે નિઃસંકોચ વાત કરશો અને કોઈપણ બાબત અસ્પષ્ટ હોય તે અમને પૂછવા મહેરબાની કરશો.

અમે અભ્યાસ કેમ કરી રહ્યા છીએ?

ગંભીર બીમારી સાથે જીવતા હોય એવા વિવિધ નૃવંશીય પૃષ્ઠભૂમિઓ (ethnic minority) ધરાવતા લોકોનાં અનુભવો વિશે અમારે જાણકારી લેવી છે. તેઓની કાળજી લેતા હોય તેવા પરિવાર અથવા મિત્રો સાથે તેમજ તેઓને મદદ કરતા ડોક્ટર અથવા નર્સ સાથે પણ વાત કરવાની અમારી ઇચ્છા છે. અમે એકત્રિત કરેલ માહિતી ડોક્ટરો અને નર્સોની તાલીમમાં તેમજ દરદીઓ અને તેમનાં પરિવારોને તેઓ દ્વારા પૂરી પાડવામાં આવતી કાળજીમાં સુધારા લાવવામાં અમને મદદરૂપ થશે.

મને કેમ આમંત્રણ આપવામાં આવ્યું છે?

તમને આ અભ્યાસમાં ભાગ લેવાનું નિમંત્રણ મળ્યું છે કારણ કે તમે ગંભીર બીમારી ધરાવો છો. તમારી ઓળખ તે ધારણાથી આરોગ્ય કાળજી લેતા વ્યવસાયિક (doctors, nurses, etc.) દ્વારા કરવામાં આવી છે જેઓ તમને સંભાળ પૂરી પાડે છે કે તમે એવા વ્યક્તિ હોઈ શકો જેઓને આ અભ્યાસમાં ભાગ લેવાની રૂચિ હોય.

શું મારે ભાગ લેવો પડશે?

ના. તમારે ભાગ લેવો જોઈએ કે નહીં તે તમારે નક્કી કરવાનું છે. જો તમે અભ્યાસમાં ભાગ લેવાનું નક્કી કરશો તો પણ તમે કોઈપણ સમયે કારણ જણાવ્યા વિના અભ્યાસમાંથી બહાર નીકળવા માટે મુક્ત છો. જો તમે ભાગ ન લેવાનું નક્કી કરો તો, તેનાથી તમારી ભાવિ તબીબી સંભાળ અથવા કાનૂની અધિકારોને કોઈ અસર થશે નહીં.

જો હું ભાગ લઈશ તો શું?

તમે સમજતા હોવ તે આ માહિતી પત્રિકા વાંચ્યા બાદ અથવા તમે સમજતા હોવ તે ભાષાનો અભ્યાસ વિડિયો જોયા બાદ અને તેની ચર્ચા સંશોધન ટીમના સદસ્ય સાથે કર્યા બાદ, જો તમે અભ્યાસમાં ભાગ લેવાનું નક્કી કરો તો તમને સંમતિ પત્રક પર સહી કરવા જણાવશે. પછી તમને સંશોધક સાથે ઇન્ટરવ્યૂ માટે આમંત્રિત કરાશે. ત્યારબાદ આગામી થોડા મહિનાઓ સુધી તમને વધુ એક અથવા બે ઇન્ટરવ્યૂઝ માટે આમંત્રિત કરવામાં આવશે. તમામ ઇન્ટરવ્યૂઝ રેકોર્ડ કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂઝ અનૌપચારિક (informal) ચર્ચાઓ હોય છે જે સામાન્યપણે આશરે 45 મિનિટનો સમય લે છે અને તે તમારા ઘરે, LOROS હોસ્પિટલ ખાતે અથવા તમારી પસંદગીના યોગ્ય સ્થળે રાખવામાં આવશે. ઇન્ટરવ્યૂઝનો સમયગાળો લાંબોટૂંકો હોઈ શકે જેનો આધાર અભ્યાસમાં તમારી રૂચિ અને તે સમયે તમારી તબિયત કેવી છે તેના પર રહે છે. ઇન્ટરવ્યૂઝ સંપૂર્ણપણે તમારી અનુકૂળતા મુજબ ગોઠવવામાં આવશે. ઇન્ટરવ્યૂ તમારી પસંદગી મુજબ અંગ્રજી સિવાયની બીજી ભાષામાં થઈ શકશે. જો આવશ્યક હશે તો અમે સંશોધકને મદદરૂપ થવા દુભાષિયો પૂરો પાડીશું.

ઇન્ટરવ્યૂઝ તમે ધરાવતા હોવ તે ગંભીર બીમારીના અનુભવ અને તમારી કાળજીનું સંચાલન કરતા આરોગ્ય સંભાળ વ્યવસાયિકો (professionals) દ્વારા તમને પ્રાપ્ત થયેલ કાળજી વિશે હશે. અમને નીચેની બાબતો વિશે જાણકારી જોઈએ છે:

- ગંભીર બીમારી ધરાવવી અને ભવિષ્યનો વિચાર કરવા વિષયક તમારો અભિગમ (view) શું છે
- આરોગ્ય સંભાળ વ્યવસાયિકો સાથે વાત કરવાના તમારા અનુભવ વિશે તમારી બીમારી વિશે અને જીવનનાં અંતિમ સમયની કાળજી અને સારવારો વિશેની તમારી પસંદગીઓ અને તમારા નિર્ણયો વિશે
- કોઈપણ ચર્ચાઓ થઈ હોય તે વિષયક ગંભીર બીમારી વિશે આરોગ્ય સંભાળ વ્યવસાયિકોએ તમને આપેલ મદદ અને માહિતી તમને કેટલી સૌથી વધુ અને સૌથી ઓછી મદદરૂપ થઈ તે વિશે તમને શું જાણકારી મળી અને શું તેમાં સુધારા લાવવા માટે કોઈ માર્ગ છે કે કેમ

તમારી પરવાનગીથી પછીથી તમારા તબીબી રેકોર્ડ્ઝના સુસંગત (relevant) ભાગો અમે મેળવીશું જેથી તમારી બીમારી અને જીવનનાં અંતિમ સમયની કાળજી અને સારવારો વિશે અમે વધુ જાણકારી મેળવી શકીએ.

અમે તમારા પરિવારના સદસ્ય અથવા મિત્રને તેમજ તમને મદદરૂપ થતા આરોગ્ય સંભાળ વ્યવસાયિકને તમને મદદ મળે તે માટે નિયુક્ત કરવા પણ જણાવીશું. આનાથી અમને તમારી બીમારી અને તમારી કાળજી વિશેના તેઓના દ્રષ્ટિકોણ વિશે વધુ જાણવામાં અમને મદદ મળશે.

તમારી પરવાનગીથી ભવિષ્યમાં અમે આ અભ્યાસમાં એકત્રિત કરેલ અનામી ડેટાનો ઉપયોગ કરી શકીએ જેથી અન્ય નૈતિક ધોરણે મંજૂર થયેલ સંશોધનને સમર્થન મળી શકે. આનો અર્થ તે થઈ શકે કે અનામી ડેટા અન્ય સંશોધકો સાથે વહેંચવામાં આવી શકાય.



આનાથી સુધારો આવી શકશે.

ભાગ લેવાના શક્યતઃ લાભ કયા છે?

અભ્યાસ તમને સીધી મદદ ન પણ કરી શકે પરંતુ કેટલાક લોકોને તેઓનો બીમારીનો અનુભવ સારવાર અને કાળજી એવા કોઈ વ્યક્તિ સાથે વહેંચવાની તક મળે જેઓ સીધા સામેલ ન હોય તેનાથી મદદ થતી હોય છે. અમે એકત્રિત કરીશું તે માહિતી વિવિધ નૃવંશીય પૃષ્ઠભૂમિઓ ધરાવતા દરદીઓ અને તેમના પરિવારોના અનુભવોને વધુ સારી રીતે આરોગ્ય સંભાળ વ્યવસાયિકો સમજી શકે તેમાં મદદરૂપ થઈ શકશે. ભવિષ્યમાં પરિવારોને પૂરી પાડવામાં આવનાર કાળજી અને મદદમાં

ભાગ લેવાના શક્યતઃ ગેરલાભો કયા છે?

અમે સમજી શકીએ છીએ કે ઇન્ટરવ્યૂ દરમિયાન તમારી બીમારી સાથે સંબંધ ધરાવતી બાબતો સાથે વાત કરવી તમારા માટે મુશ્કેલીભર્યું હોઈ શકે અથવા નિરાશાજનક હોઈ શકે. અમે આપને જણાવીએ છીએ કે આનો કાળજીપૂર્વક વિચાર કરશો, કૃપા કરી યાદ રાખશો કે તમારે ચર્ચા ન કરવાની ઇચ્છા હોય એવા કોઈપણ વિષયો વિશે વાત કરવા અથવા પ્રશ્નોનાં જવાબો આપવા માટે તમે ક્યારેય દબાણમાં નહીં હશો. તમે કોઈપણ સમયે ઇન્ટરવ્યૂ બંધ કરી શકો અથવા તમારી તે ઇચ્છા હોવાનું સંશોધકને જણાવીને કોઈપણ સમયે અભ્યાસમાંથી બહાર નીકળી શકો છો.

ભાગ લેવા માટે શું મને કોઈ ચૂકવણી પ્રાપ્ત થશે?

પ્રત્યેક ઇન્ટરવ્યૂ પછી તમને તમારો સમય આપવા માટે "આભાર દર્શન" તરીકે £20નું વાઉચર આપવામાં આવશે. તમારી સહભાગિતાના પરિણામે જો તમને કોઈપણ પ્રવાસ ખર્ચ થાય તો જાહેર પરિવહનની (public transport) રસીદ જમા કરાવી તેની ભરપાઈ થઈ શકે અથવા LOROSના માનક દર અનુસાર મહત્તમ £20 સુધીની રકમ માઇલેજના દાવા તરીકે રકમની ભરપાઈ કરી શકાશે.

શું મારી માહિતી ગોપનીય રાખવામાં આવશે?

હા આ અમારે માટે ઘણી અગત્યની છે. હાલનાં ડેટા સુરક્ષા નિયમો અનુસાર અભ્યાસ આચરવામાં આવશે. એકત્રિત કરવામાં આવેલ તમામ માહિતી અચૂકપણે ગોપનીય રાખવામાં આવશે અને તે LOROS હોસ્પિટલ ખાતે તાળાબંધ કાર્યાલયની અંદર તાળાબંધ કબાટમાં સંગ્રહિત રહેશે. તમામ માહિતી જે કોમ્પ્યુટર પર સંગ્રહ કરેલ હશે તે પ્રતિબંધિત પહોંચ ધરાવતી પાસવર્ડથી સુરક્ષિત ફાઇલ્સમાં રખાશે.

ઇન્ટરવ્યૂની ટેપ્સ સુરક્ષિત રીતે લાયકાત ધરાવતા વ્યવસાયિક (ટ્રાન્સક્રાઇબર)ને મોકલવામાં આવશે જેઓ તે સાંભળીને તેને લેખિત દસ્તાવેજમાં (ટ્રાન્સક્રિપ્ટ) રૂપાંતરિત કરશે. ઇન્ટરવ્યૂની ટ્રાન્સક્રિપ્ટોમાંથી તમારું નામ અને ઓળખાણ આપતી વિગતો દૂર કરાશે અને તેની અવેજીમાં અભ્યાસ ઓળખ ક્રમાંક મુકાશે (અનામીકરણ) જેથી તમને ઓળખી શકાય નહીં. સુરક્ષિત LOROS કમ્પ્યુટરોમાં તબદીલ થયા બાદ તમામ ઇન્ટરવ્યૂના રેકોર્ડિંગ્સ રેકોર્ડરમાંથી ભૂંસી નાંખવામાં આશે.

અમે તમારા GPને જાણ કરીશું કે તમે આ અભ્યાસમાં ભાગ લઈ રહ્યા છો જેથી તેઓ આને તમારા તબીબી રેકોર્ડ્સમાં દસ્તાવેજીત કરી શકે.



જવી કે કેમ.

દેખરેખ અને ઓડિટના હેતુસર અભ્યાસ ડેટાની પહોંચ સંશોધન ટીમના સદસ્યોને જ હશે પરંતુ તેને પ્રાયોજકના પ્રતિનિધિઓ, નિયમન સત્તાઓ અથવા યજમાન NHS સંગઠનો પણ જોઈ શકશે.

ગોપનીયતાનો ભંગ માત્ર એવા સંજોગોવસાત થઈ શકશે જો સંશોધકોને એવી ક્રિયા કે પરિસ્થિતિઓથી અવગત કરવામાં આવ્યા હોય જેને પરિણામે તમને અથવા અન્ય લોકોને ગંભીર જોખમનો સામનો કરવો પડ્યો હોય અથવા નુકસાન થયું હોય. આ કિસ્સામાં સંશોધકો તમારી સાથે આની ચર્ચા કરશે અને વિચાર કરશે કે શું આ બાબત સંડોવાયેલ સર્વિસના સંચાલકો સમક્ષ લઈ

તમામ અભ્યાસ ડેટા અભ્યાસના સમયગાળા દરમિયાન સુરક્ષિત રીતે સંગ્રહિત રહેશે અને સુરક્ષિત રીતે તેનો નિકાલ કરવામાં આવે ત્યાર પહેલા સાત વર્ષ સુધી રાખવામાં આવશે.

ડેટા સુરક્ષા અને સામાન્ય ડેટા સુરક્ષા નિયમો

આ અભ્યાસના પ્રાયોજક UK સ્થિત યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટ (UHL) છે. આ અભ્યાસ આચરવા માટે LOROS અને UHL તમારી પાસેથી માહિતીનો ઉપયોગ કરશે અને અભ્યાસ માટે UHL ડેટા નિયંત્રકની ભૂમિકામાં હશે. આનો અર્થ તે થાય કે અમે તમારી માહિતી અને તેના યોગ્ય ઉપયોગ માટે જવાબદાર છીએ.

તમારી માહિતીમાં પરિવર્તન અને ખસેડવાની પહોંચના તમારા અધિકારો મર્યાદિત છે કારણ કે અમારે માટે જરૂરી છે કે સંશોધન વિશ્વસનીય અને સચોટ રહે તે માટે અમે તમારી માહિતીનું સંચાલન વિશિષ્ટ રીતે કરીએ. જો તમે અભ્યાસમાંથી નીકળી જાવ તો અમે તમારા વિશેની માહિતી રાખીશું જે અમે અગાઉથી સંપાદિત કરી હતી. તમારા અધિકારોની સુરક્ષા માટે અમે સંભવિત વ્યક્તિગત-ઓળખ કરી શકે તેવી માહિતીનો ઓછામાં ઓછો ઉપયોગ કરીશું.

આ સંશોધનના હેતુઓસર તમારો ડેટા એકત્ર કરવાનો કાનૂની આધાર વિશિષ્ટ સંમતિ (your consent) છે.

આ સંશોધન માટે તમારા વિશેનો જે ડેટા અમે એકત્ર કરીશું, જેના પર પ્રક્રિયા કરીશું અને જેનો સંગ્રહ કરીશું તે નીચે સૂચિત છે:

- તમારું નામ અને વ્યક્તિગત સંપર્ક વિગતો
- ઇન્ટરવ્યૂની ટ્રાન્સ્ક્રિપ્ટો
- તમારી બીમારી અને જીવનના અંતિમ સમયની કાળજી અને સારવારો વિશે વધુ જાણવા માટે તમારી તબીબી નોંધોમાંથી એકત્ર કરવામાં આવેલ માહિતી

યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટ જે રીતે સંશોધન માટે ડેટાનો ઉપયોગ કરે છે તે વિશે વધુ માહિતી માટે કૃપા કરીને ટ્રસ્ટની સાર્વજનિક વેબસાઇટ પર ગોપનીયતા નિવેદન જુઓ:

<https://www.leicestershospitals.nhs.uk/aboutus/about-this-website/privacy/data-protection/>

આરોગ્ય સંશોધન સત્તા પાસેથી વધુ માહિતી અહીં મળી શકશે: <https://www.hra.nhs.uk/information-about-patients/>

જો મારી અભ્યાસમાં ચાલુ રહેવાની ઇચ્છા નહીં હોય તો શું થશે?

અભ્યાસમાં તમારી સહભાગિતા સ્વૈચ્છિક છે અને તમે આ પત્રિકાના અંતે આપેલ સંપર્ક વિગતોનો ઉપયોગ કરીને સંશોધન ટીમનો સંપર્ક કરી કોઇપણ સમયે અભ્યાસમાંથી નીકળી જવા માટે મુક્ત છો. તમારે કારણ આપવાની જરૂર નથી અને તમારી તબીબી કાળજી અને કાનૂની અધિકારો પ્રભાવિત થશે નહીં. જો તમે અભ્યાસમાંથી નીકળી જવાનું નક્કી કરો તો નીકળવાના સમય સુધી એકત્રિત કરેલ અનામી થયેલ માહિતી તેમ છતાં પણ ઉપયોગમાં લેવાશે.

જો હું અભ્યાસ દરમિયાન ભાગ લેવાની ક્ષમતા ગુમાવું તો શું થશે?

એવા કમનસીબ સંજોગવસાત જો તમે વધુ બીમાર પડો અને આ સંશોધન અભ્યાસમાં સહભાગિતા ચાલુ રાખવી કે નહીં તે નક્કી કરવાની ક્ષમતા ગુમાવો તો અમે એવા કુટુંબીજન અથવા મિત્રનો સંપર્ક તેઓના અભિપ્રાય માટે સાધીશું જેઓ તમને સારી રીતે ઓળખતા હોય. જો તેઓ સહમત થાય તો અમે તેઓને કન્સલ્ટી એટલે કે પરામર્શ કરનાર તરીકે બાકીના અભ્યાસ માટે તમારા વતી સૂચન આપવા માટે નિયુક્ત કરીશું. તમારા ચાલુ રહેવા અંગે જે કોઇ નિર્ણય લેવામાં આવે, તે સમય સુધી અભ્યાસમાં તમારા વિશે એકત્ર કરવામાં આવેલ માહિતીનો અમે ઉપયોગ કરીશું અને તમારી મૂળ સંમતિ અનુસાર યોગ્ય રીતે તબીબી રેકોર્ડ્સ જોઇશું.

કંઈક ખોટું થઇ જાય તો શું?

આ પ્રકારના સંશોધન અભ્યાસમાં ભાગ લેવાથી નુકસાન પહોંચે તેવી સંભાવના બહુ ઓછી છે.

જોકે, તમને અભ્યાસના કોઇપણ પાસાને લગતી કોઇ ચિંતા હોય, તો તમારે સંશોધકો સાથે પહેલેથી જ વાત કરવી જોઇએ જેઓ તમારા પ્રશ્નોના જવાબ આપવા તેમનાથી બનતા શ્રેષ્ઠ પ્રયાસ કરશે. જો તમે નાખુશ જ રહો અને તમારી ચિંતા અથવા ફરિયાદોને ઔપચારિક (formal) રીતે વાચા આપવા માંગતા હોવ તો તમારે પેશન્ટ ઇન્ફોર્મેશન એન્ડ લિએઝન સર્વિસ (PILS)નો સંપર્ક ફ્રી ફોન લાઇન: 08081 788337 પર કરવો જોઇએ અથવા વિકલ્પ તરીકે અહીં લખો: Patient Information and Liaison Service, The Firs, C/O Glenfield Hospital, Groby Road, Leicester, LE3 9QP ઇમેલ: pils@uhl-tr.nhs.uk

એવી બનવાજોગ ઘટના થાય જ્યારે કંઈક ખરેખર ખોટું થાય અને અને સંશોધન દરમિયાન તમને નુકસાન પહોંચે અને તે કોઇ વ્યક્તિની બેદરકારીને કારણે હોય તો તમારી પાસે વળતર માટે કાનૂની પગલા ભરવાના કારણો હોઇ શકે પરંતુ તમારે કાનૂની ખર્ચની ચુકવણી પોતે કરવાની રહેશે. તેમ છતાં તમને સામાન્ય NHS ફરિયાદો કરવાની પ્રક્રિયાઓ ઉપલબ્ધ રહેશે.

અભ્યાસનાં પરિણામોનું શું થશે?

અભ્યાસના પરિણામોનો ઉપયોગ ગંભીર બીમારી દરમિયાન આરોગ્ય સંભાળ વ્યવસાયિકો અને સેવાઓ જે કાળજી અને મદદ દરદીઓ અને પરિવારોને પૂરી પાડે છે તેમાં સુધારા કરવા માટે થશે. સંશોધકો NHS માટે અહેવાલ તૈયાર કરશે જેઓએ અભ્યાસનું ભંડોળ પૂરું પાડ્યું છે. સંશોધનના પરિણામો બહોળા પ્રમાણમાં જનતા અને

વ્યવસાયિકોને વ્યાખ્યાનો તેમજ પ્રકાશનો અને કોન્ફરન્સ પ્રેઝન્ટેશનો મારફત ઉપલબ્ધ કરાશે. અમે ઇન્ટરવ્યૂમાંથી સીધા ઉતારાનો સમાવેશ કરી શકીએ પરંતુ તેમાં કોઈ અંગત વિગતો સમાયેલ નહીં હશે અને તેમાંથી તમારી ઓળખ થઈ શકશે નહીં. આ સંશોધનમાંથી ઉદ્ભવે તેવા કોઈપણ પ્રકાશનનાં અહેવાલમાં તમારી ઓળખ થઈ શકશે નહીં.

તમારી પરવાનગીથી ભવિષ્યમાં અમે આ અભ્યાસમાં એકત્રિત કરેલ અનામી ડેટાનો ઉપયોગ કરી શકીએ જેથી અન્ય નૈતિક ધોરણે મંજૂર થયેલ સંશોધનને સમર્થન મળી શકે. આનો અર્થ તે થઈ શકે કે અનામી ડેટા અન્ય સંશોધકો સાથે વહેંચવામાં આવી શકાય.

સંશોધનનું આયોજન તથા નિધિયન કોણ કરે છે?

LOROS હોસ્પિટલ્સ ખાતેની સંશોધન ટીમ દ્વારા સંશોધન કરવામાં આવી રહ્યું છે અને યુનિવર્સિટી હોસ્પિટલ્સ ઓફ લેસ્ટર NHS ટ્રસ્ટ અભ્યાસનાં પ્રાયોજક છે. સંશોધનનું ભંડોળ NHS નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ રિસર્ચ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે.

અભ્યાસની સમીક્ષા કોણે કરી છે?

અભ્યાસની સમીક્ષા પ્રાયોજક અને હેલ્થ રિસર્ચ ઓથોરિટી દ્વારા કરવામાં આવી ચૂકી છે જેમાં રિસર્ચ એથિક્સ કમિટીની સમીક્ષાનો સમાવેશ થાય છે.

મારે હવે શું કરવું?

જો તમને ભાગ લેવામાં અથવા વધુ માહિતી મેળવવામાં રસ હોય તો કૃપા કરી ફોન, ઇમેલ અથવા ટપાલ દ્વારા નીચે આપેલ સંપર્ક વિગતોનો ઉપયોગ કરી સંશોધન ટીમનો સંપર્ક કરશો.

કૃપા કરીને નોંધો કે LOROS.co.uk એ સુરક્ષિત ઇમેઇલ સરનામું નથી, અને તેથી તમે ઇમેઇલ દ્વારા મોકલો છો તે કોઈપણ માહિતી એન્ક્રિપ્ટ થશે નહીં. આનો અર્થ એ છે કે હેકર્સ અથવા અન્ય લોકોનાં હાથમાં જો એ આવે તો તેમને વાંચતા રોકવા માટે તે કોડેડ થયેલ નથી અથવા પાસવર્ડ સુરક્ષિત નથી.

જો તમે ટપાલ મારફત જવાબ આપવાનું પસંદ કરો તો રિપ્લાય સ્લિપ પાછી મોકલવા માટે તમને ફ્રીપોસ્ટ પરબિડીયું પૂરું પાડવામાં આવી રહ્યું છે. પછી અભ્યાસ વિશે વધુ ચર્ચા કરવા માટે અને તમને હોય તેવા કોઈપણ પ્રશ્નોનાં જવાબ આપવા સંશોધન ટીમ તમારો સંપર્ક કરશે.

જરૂર હોય તો, તમારા વતી ભાષાંતર કરવા અને સહભાગી થવામાં તમને સહાય પૂરી પાડવા ઉચિત લાયકાત ધરાવતા અનુવાદક પૂરા પાડવામાં આવી શકે.

જો તમારે ભાગ લેવો ન હોય તો તમારે કંઈ કરવાનું રહેશે નહીં અને અમે તમારા સમય અને આ બાબતે ધ્યાન આપવા માટે તમારો આભાર માનીશું.

વધુ માહિતી અને સંપર્ક વિગતો

જો તમને કોઈ વધુ પ્રશ્નો હોય અથવા કોઈ વધુ માહિતી મેળવવી હોય તો કૃપા કરી નિઃસંકોચ **LOROS** રિસર્ચ ટીમનો સંપર્ક **0116 231 8498** પર અથવા ઇમેલ research@loros.co.uk પર કરશો. તમારી ચિંતાઓની ચર્ચા કરવા અને પ્રશ્નોના જવાબો આપવામાં અમારી ટીમને આનંદ થશે